



KEMISTAR CORPORATION LTD.

CIN No. : L24233GJ1994PLCO22845

604, Manas Complex, Jodhpur Cross Road, Satellite, Ahmedabad-380015,
Gujarat, India. **Ph** : 079-26923570 / 26923587 **Email** : kemistarbse@gmail.com

July 02, 2020

To,
BSE Limited,
Listing Dept. /Dept. of Corporate Services,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai – 400 001

Dear Sir/ Madam,

Subject: Submission of Newspaper Clipping

Ref.: Regulation 47 (1) (a) of SEBI (Listing Obligation and Disclosure Requirement) Regulations, 2015

Scrip code: 531163

Security ID: KEMISTAR

Please find enclosed herewith Newspaper Clipping of the Notice of Board Meeting as per Regulation 47 (1) (a) of SEBI (Listing Obligation and Disclosure Requirement) Regulations, 2015 for approval of audited Standalone and Consolidated Financial Results for the Quarter and year ended on March 31, 2020 published in Newspaper on Thursday, July 02, 2020 for your records.

Kindly acknowledge the receipt of the same.

Thanking You,

For, Kemistar Corporation Limited



Sheeja Mohan
Company Secretary
(M No. 48252)

Torn milk is also beneficial for health, increases immunity and reduces body cholesterol



Milk often breaks during summer. So many of us do not like to eat the bitter sour taste out of the cottage cheese and throw away the remaining milk and water and make this paneer vegetable and eat it. At the same time, some people find the taste of the cheese made from it to be sour, so they throw it away. While its sour diet prepares it as a more healthy probiotic food, which is extremely beneficial for the stomach. At the same time, the benefits of cracked milk are many, which we and you do not even know. So let us tell you in detail the benefits of sour milk.

It is beneficial to increase immunity
Torn milk is rich in various vitamins of the vitamin B-group (especially vitamins B2, B5 and B12). Some of them come from basic milk and some are produced by living lactic acid bacteria. While being fermented, lactic acid in the composition of milk products stimulates the functions of various digestive glands, so it promotes the digestive process. Gut bacteria benefit from this and immunity is better (sour milk to boost immune system). At the same time, it also contains a good amount of probiotic bacteria, which are also known to increase immunity. At the same time, due to its antibiotic effect we can avoid many types of infections.

Beneficial for the stomach
Torn milk is easy to digest and our digestive system can easily assimilate it. In addition, they improve appetite, stimulate pancreas and liver functions and bile secretion. In fact, cracked milk also has some acidic properties, which is also filled with partial characteristics of yogurt, thus their composition becomes similar to amino acids and they are well absorbed in our bloodstream.

Cracked milk prevents seasonal allergies
Torn milk contains 2.9% protein. This milk is a somewhat altered state of casein due to the activity of living lactic bacteria, which reduces the chances of allergy. Torn milk causes less allergy to protein than protein in fresh milk.

Low cholesterol
If you consume cracked milk, the cholesterol remains in the level control (sour milk to reduce cholesterol levels). If cholesterol is controlled, then you will avoid heart related problems like heart attack and stroke etc. Torn milk water contains a lot of protein. Consuming it daily also increases the strength of your muscles.

Low caloric cracked milk
2.5% fat-rich cracked milk gives you less calories even if you eat too much. In such a situation, it is very beneficial for people suffering from weight gain. Those who have problems digesting milk sugar should emphasize the suitability of sour milk, as in the case of other fermented milk products. Sour milk has a low lactose content, but in terms of minerals, sour milk contains a large amount of calcium, potassium, manganese, phosphorus, sulfur and sodium compounds.

'Mere Desh Ki Dharti' slated to release on 14th August 2020 in theatres



Ahmedabad, 'Mere Desh Ki Dharti' starring Divyendu Sharma, Anant Vidhaat and Anurupya Goenka in lead roles is slated to release on 14th August 2020 in theatres. The film is a humorous take on the contemporary situation where rural and urban divide comes into the fore. It is the story of two engineers and their transformed journey that they take in life. It is a patriotic-family drama that involves a concerning social subject communicated to the masses in a very refined narrative. The team of Mere Desh Ki Dharti is currently in the process of post-production activities. Majority part of the film was shot in Sehore district of Bhopal in January followed by Mumbai in February and March. (19-10)

Printed & Published by Moyer C. Bhatt on behalf of Kalyani Pub. Pvt. of printed at: Mahadov Office, H-47 Ravli Estate, Rustam Mill Compound, Dushdeshwar, Ahmedabad-4. Published from 201-2, Nandan Com. Opp. Mithakhali Rly Crossing, Mithakhali, Ah-6 Dist. - Moyer Bhatt

Western Railway transported 16.21 Million Tonnes Through More than 7700 Rakes Of Goods Trains



Ahmedabad, Despite complete lockdown imposed from 22nd March, 2020, Western Railway has done commendable work by loading 7,773 rakes of goods trains till 29th June, 2020, including various essential commodities such as POL - 851, Fertilizers - 1174, Salt - 433, Foodgrain - 81, Cement - 506, Coal - 299, Containers - 3919 & General Goods - 38 rakes, amounting to 16.21 Million Tonnes to different states of the country, including North East region. In addition to this 371 rakes of Millennium Parcel Van and Milk Tank Wagons containing various essential commodities such as medicine, medical kits, frozen food, milk powder and liquid milk were loaded to Northern & North East region. Total 15328 Freight trains were interchanged with other Railways including 7680 trains handed over and 7648 trains taken over at different interchange points of Western Railway. During the period, important inward rakes such as 1021 rakes of Jumbo, 567 rakes of BOXN and 451 rakes of BTPN were unloaded despite shortage of labour.

According to a press release issued by Western Rly, since 23rd March to 29th June, 2020, Bhatia Communications & Retail (India) Limited
CIN : L32109GJ2008PLC053336
Regd Off: 132, Dr. Ambedkar Shopping Centre, Ring Road, Surat-395002
Website: www.bhatiamobile.com, mail: info@bhatiamobile.com, Ph: 0261-2349892

NOTICE OF POSTAL BALLOT

NOTICE is hereby given, in accordance with the provisions of Section 108 and 110 of the Companies Act, 2013, as amended ("the Act") read with Rules 40 and 41 of the Companies (Management and Administration) Rules, 2014 ("the Rules") (including any statutory modification or re-enactment thereof for the time being in force) and all other applicable provisions of the Companies Act, 2013 and rules made there under, Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and other applicable laws and regulations, that the approval of members of Bhatia Communications & Retail (India) Limited ("the Company") is being sought for Migration of Company from SME Exchange to Main Board Platform of BSE Limited and For Alteration of Article of Association of the Company. Detailed business have been provided in the notice of Postal Ballot dated 30th June, 2020, through remote electronic voting (remote e-voting) by the process of postal ballot.

On account of threat posed by COVID-19 and in accordance with General Circular No. 17/2020 dated April 13, 2020 read with General Circular No. 14/2020 dated April 8, 2020 issued by Ministry of Corporate Affairs, the Company has completed the dispatch of Postal Ballot Notice in electronic form i.e. through e-mail on 1st July, 2020 to all the shareholders of the Company whose names appear in the Register of Members as maintained by the Registrar and Share Transfer Agent of the Company and beneficial owners as received from the Depositories on Friday, 26th June, 2020 ("Cut Off Date") and hard copy of this Notice along with postal ballot forms and pre-paid business envelope will not be sent to the shareholders for this postal ballot. Accordingly, the communication of the assent or dissent of the members would take place through the remote e-voting system only.

In light of the MCA Circulars, for remote e-voting for this postal ballot, the shareholders whether holding equity shares in demat form or physical form and who have not submitted their email addresses and in consequence to whom the remote e-voting notice could not be serviced, may temporarily get their e-mail addresses registered with the Company's Registrar and Share Transfer Agent, Purva Share Registry (India) Private Limited, by clicking the link: <https://www.purvashare.com/> email and phone updation and follow the registration process as guided thereafter. Post successful registration of the e-mail address, the shareholders would get soft copy of this Notice and the procedure for remote e-voting along with the user id and the password to enable e-voting for this postal ballot. In case of any queries, shareholder may write to the Company at info@bhatiamobile.com or to Registrar and Transfer Agent at support@purvashare.com.

The Company has entered into an agreement with National Securities Depository Limited (NSDL) for facilitating remote e-voting to all the Members. Members may note that the voting period commences from Friday, 3rd July, 2020 (09:00 A.M.) and will end on Saturday, 1st August, 2020 (05:00 P.M.) both days inclusive. During this period, a person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on Friday, 26th June, 2020 ("Cut-off date") only shall be entitled to avail the facility of remote e-voting and such Members may cast their vote electronically. The e-voting module will be disabled for voting thereafter by NSDL and remote e-voting shall not be allowed beyond the said cut-off date. Once vote on a resolution is cast by the member, he/ she shall not be allowed to change it subsequently or cast the vote again. The detailed procedure for voting has been mentioned in the Postal Ballot Notice. The Board of Directors of the Company has appointed CS Ranjit Kejriwal, Company Secretary in Practice (COP No. 5985) as the Scrutinizer for conducting the postal ballot and remote e-voting and to scrutinize the votes received through remote e-voting in a fair and transparent manner.

The result of postal ballot shall be declared on or before Monday, 3rd August, 2020 at the registered office of the Company and will also be posted on the Company's website www.bhatiamobile.com and communicated on the same day to stock exchange, depository, registrar and share transfer agent and e-voting agency. Member who does not receive the Postal Ballot Notice may send an e-mail to info@bhatiamobile.com or may apply to Registrar and Transfer Agent of the Company at support@purvashare.com and obtain a copy of Postal Ballot Notice. The Postal Ballot Notice can also be downloaded from the website of the Company www.bhatiamobile.com and website of e-voting agency <https://www.evoting.nsdl.com>. Any query/ grievance with respect to the voting by remote electronic, mean may please be addressed to Ms. Mittal Narendrabhai Shah, Company Secretary and Compliance Officer, Bhatia Communications & Retail (India) Limited at 132, Dr. Ambedkar Shopping Centre, Ring Road, Surat-395002 or at Email id: info@bhatiamobile.com or on +91 261-2349892 to R&TA of the Company at support@purvashare.com.

For Bhatia Communications & Retail (India) Limited

Date: 02nd July, 2020
Place: Surat

SEKIMSTAR CORPORATION LIMITED

CIN : L24233G1994PLC022845
Registered Office: 604, Manas Complex, Near Jodhpur Cross Road Satellite, Ahmedabad Gujarat- 380015
Email: kemistarbse@gmail.com Website: www.kemistar.in

NOTICE

Notice is hereby given Pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that the Meeting of the Board of Directors of the Company will be held on Monday, July 06, 2020 at the registered office of the Company, inter-alia, to consider & approve the Consolidated and Standalone Audited Financial Results for the quarter and year ended on March 31, 2020. The information contained in this notice is also available on the company's website at www.kemistar.in and on the website of Bombay Stock Exchange at www.bseindia.com

FOR KEMISTAR CORPORATION LIMITED

Date : July 01, 2020
Place: Ahmedabad

commodities weighing more than 67 Thousand tonnes have been transported by Western Rly through its 370 parcel special trains, which mainly included agricultural produce, medicines, fish, milk etc. The earnings generated through this transportation, has been approxRs 21.73 crore. During this period, 50 milk special trains were run by Western Rly, with a load of more than 37 thousand tonnes and 100% utilization of the wagons, generating revenue of approx. Rs 6.45 crore. Similarly, 312 Covid-19 special parcel trains with a load of more than 26 thousand tonnes were also run with almost 100% utilization generating revenue of about Rs 1.76 crore.

GUJARAT TOOLROOM LIMITED

(CIN : L45208G11983PLC06056)
(Regd. Office- 402, Sheel Complex, Nr. Mithakhali Under Bridge, Navrangpura, Ahmedabad-380009)
Email: gujtoolroom@gmail.com Website: www.gujarattoolroom.com

STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 31ST MARCH, 2020

Sr. No.	Particulars	Quarter Ended		Year Ended	
		31-03-2020 (Unaudited)	31-12-2019 (Unaudited)	31-03-2020 (Unaudited)	31-03-2019 (Audited)
1	Income	-	-	-	-
	Revenue from Operations	-	-	-	-
	Other Income	-	-	-	-
	Total Income	-	-	-	-
2	Expenses	-	-	-	-
	(a) Purchases of stock-in-trade	-	-	-	-
	(b) Changes in inventories of stock-in-trade	-	-	-	-
	(c) Employee benefits expense	-	-	-	-
	(d) Finance costs	-	-	-	-
	(e) Depreciation and amortisation expense	-	-	-	-
	(f) Other expenses	-	-	-	-
	(g) Foreign exchange loss / (gain)	4.21	0.37	3.87	5.10
	Total Expenses	4.21	0.37	0.17	5.10
	Profit before exceptional items and tax (1-2)	(4.21)	(0.37)	(0.17)	(4.86)
4	Add/(Less) : Exceptional items (net)	-	-	-	-
5	Profit before tax (3+4)	(4.21)	(0.37)	(0.17)	(4.86)
6	Tax expense	-	-	-	-
	(a) Current Tax	-	-	-	-
	(b) Deferred Tax	-	-	-	-
	Total Tax Expense	-	-	-	-
7	Profit / (Loss) for the period (5-6)	(4.21)	(0.37)	(0.17)	(4.86)
8	Other Comprehensive Income:	-	-	-	-
	(a) Items that will not be reclassified to profit or loss	-	-	-	-
	(b) Income tax relating to items that will not be reclassified to profit or loss	-	-	-	-
	(c) Items that will be reclassified to profit or loss	-	-	-	-
	(d) Income tax relating to items that will be reclassified to profit or loss	-	-	-	-
	Other Comprehensive Income	-	-	-	-
9	Total Comprehensive Income for the period (7+8)	(4.21)	(0.37)	(0.17)	(4.86)
10	Paid-up Equity Share Capital (Face Value of Rs. 1 each)	69.54	69.54	69.54	69.54
11	Other Equity	-	-	-	-
11#	Earning per share (Face Value of ₹ 1 each) (Not audited):	(0.61)	(0.05)	(0.02)	(0.70)
	Back & Diluted	(0.61)	(0.05)	(0.02)	(0.70)

STATEMENT OF ASSETS AND LIABILITIES AS AT 31ST MARCH, 2020

Sr. No.	Particulars	Standalone	
		31-03-2020 (Audited)	31-03-2019 (Audited)
ASSETS			
1	Non-Current Assets	-	-
11	Current Assets	-	-
(a)	Inventories	-	-
(b)	Financial Assets	-	-
	(i) Cash & Cash Equivalents	0.27	0.29
	(ii) Loans	42.40	43.64
	Total Current Assets	42.67	43.93
	Total Assets	42.67	43.93
EQUITY AND LIABILITIES			
EQUITY			
(a)	Equity Share Capital	69.54	69.54
(b)	Other Equity	(38.42)	(33.32)
	Equity attributable to owners of the Company	31.12	36.22
(c)	Non-Controlling Interests	-	-
	Total Equity	31.12	36.22
LIABILITIES			
1	Non-Current Liabilities	-	-
11	Current Liabilities	-	-
(a)	Financial Liabilities	-	-
	(i) Borrowings	3.71	3.41
	(ii) Trade Payables	0.84	0.83
	Total outstanding dues of micro enterprises and small enterprises	0.84	0.83
	Total outstanding dues of creditors other than micro enterprises and small enterprises	7.00	3.47
	Total Current Liabilities	11.55	7.71
	Total Equity and Liabilities	42.67	43.93

STATEMENT OF CONDENSED CASH FLOWS FOR THE HALF YEAR ENDED 31ST MARCH, 2020

Sr. No.	Particulars	(Rs. in lakhs)	
		Year ended 31-03-2020	Year ended 31-03-2019
A	Cash flow from operating activities	-	-
	Profit before tax	(5.10)	(4.86)
	Operating Profit / (Loss) before working capital changes	(5.10)	(4.83)
	Net cash (used in) from operating activities (A)	(1.56)	(1.47)
B	Net cash generated / (used in) from investing activities (B)	1.24	0.90
C	Net cash (used in) / generated from financing activities (C)	0.30	(0.02)
	Net increase in cash and cash equivalents (A)+(B)+(C)	(0.02)	(0.59)
	Cash and cash equivalents at the beginning of the period	0.29	0.88
	Cash and cash equivalents at the end of the period	0.27	0.29

- Notes:
- The above Financial Results have been reviewed by the Audit Committee and subsequently approved by the Board of Directors at their meetings held on 22nd June, 2020.
 - The Statutory Auditors have carried out limited review of the above Financial Results for the quarter and year ended 31st March, 2020.
 - The Financial results of the Company have been prepared in accordance with the Indian Accounting Standards ("Ind AS") as prescribed under Section 133 of the Companies Act, 2013 read with the relevant rules issued thereunder.
 - Previous year's figures have been regrouped / rearranged wherever necessary, to conform to the current period's classification.

For & on behalf of the Board,
Vishal Shah
Director
(DIN:03279724)
Date : 22.06.2020
Place : Ahmedabad

